

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટને ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ વિડીયો માટે માર્કેટિંગ એવોર્ડ જીત્યો

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (માર્ચ 10, 2022) – સીટી ઓફ બ્રેમ્પટને પોતાના [ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ વિડીયો](#) માટે ઈકોનોમિક ડેવલપર્સ એસોસિએશન ઓફ કેનેડા (EDAC) નો માર્કેટિંગ કેનેડા એવોર્ડ જીત્યો છે.

સીટીએ નવીન શોધ અને ઉદ્યોગ સાહસિકતા ઈકોસિસ્ટમ: બ્રેમ્પટન ઈનોવેશન ડિસ્ટ્રિક્ટનું નિર્માણ કરીને પોતાના ડાઉનટાઉનની આર્થિક સંભાવિતતા પુનર્જીવિત કરવાનું અને ઉઘાડવાનું ચાલુ રાખ્યું છે. ઓક્ટોબર 2021 માં, બ્રેમ્પટન ઈકોનોમિક ડેવલપમેન્ટ ઓફિસે આ ઈનોવેશન ઈકોસિસ્ટમના પ્રભાવો પ્રકાશિત કરવા પોતાનો ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ વિડીયો શરૂ કર્યો.

ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ સ્ટાર્ટ-અપ સ્કેલિંગ, રોકાણ આકર્ષણ અને પ્રતિભા વિકાસ પર સખત ધ્યાન આપે છે, અને ઉદ્યોગ સાહસિકો અને નવા ધંધા માટે સ્થાનિક સહાયતા પૂરી પાડે છે. તેઓ નવી ટેકનોલોજી ઊભી કરવા ઈનોવેશન અને ટેકનોલોજી કંપનીઓને સહાય કરવા સંસાધનો પણ આપે છે. વર્ષ 2019 માં કરારોની શરૂઆત કરીને, સીટીએ પોતાના ઈનોવેશન ડિસ્ટ્રિક્ટમાં આશરે \$20.5 મિલિયનનું રોકાણ કરવાની કટિબદ્ધતા દર્શાવવાની સાથે, ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ ભાગીદારો દ્વારા વધારાનું આશરે \$55.2 મિલિયનનું રોકાણ ખેંચી લાવશે.

વર્ષ 2019 થી 2021 સુધીમાં, છ નવા ભાગીદારોએ ઈનોવેશન ડિસ્ટ્રિક્ટમાં પોતાની હાજરી સ્થાપિત કરી છે. ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ ભાગીદારોમાં સામેલ છે, ઉદ્યોગસાહસિકતા, બિઝનેસ ઈનક્યુબેશન, માધ્યમિક-પર્યંત તાલીમ, અને એક્સેલરેટર સ્પેસીસ જેમ કે બ્રેમ્પટન એન્ટરપ્રેન્યોર સેન્ટર, BHive બ્રેમ્પટન, ધી રાયરસન-લેડ વેન્યર ઝોન, અલ્ટિટ્યુડ એક્સેલરેટર, ધી ફાઉન્ડર ઈન્સ્ટિટ્યુટ, અલ્ગોમા યુનિવર્સિટી, અને ધી રોજર્સ સાઈબરસિક્યુરિટી કેટાલિસ્ટ હેડક્વાર્ટર્સ અને એક્સેલરેટર. ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ બનાવવામાં મહત્વના ભાગીદારો શેરિડેન એજ, બ્રેમ્પટન બોર્ડ ઓફ ટ્રેડ એન્ડ ડાઉનટાઉન બ્રેમ્પટન BIA પણ છે.

કાઉન્સિલની અગ્રતાઓની પરિભાષાને આગળ વધારતા, ચાલુ પરિવર્તનશીલ પહેલોથી સંપૂર્ણ સમુદાયો બનાવવામાં, આર્થિક સંભાવના ઉઘાડવામાં અને ઈનોવેશન કોરિડોર પર બ્રેમ્પટનની અજોડ સ્થિતિ પ્રબળ બનાવવામાં મદદ મળશે.

COVID-19 મહામારીના સમગ્ર સમયગાળા દરમિયાન, સીટીએ ડાઉનટાઉનના રોકાણને પ્રોત્સાહન આપવાનું અને બ્રેમ્પટનના હાર્ટમાં નવા વિકાસ કામો વધારે તીવ્ર બનાવવાનું ચાલુ રાખ્યું છે. શહેરના ઈનોવેશન ડિસ્ટ્રિક્ટનો સતત વિકાસ તેની આર્થિક રિક્વરી વ્યૂહરચનાનો મુખ્ય ભાગ છે, અને સાઈબર સિક્યુરિટી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા સતત વિકાસ માટે તૈયાર ક્ષેત્રો પર ધ્યાન આપીને તે શહેરને વૈશ્વિક મહામારીના પ્રભાવોમાંથી આગળ લઈ જવામાં મદદરૂપ થશે.

ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ વિશે વધુ જાણવા વેબસાઈટ www.bramptoninnovationdistrict.com જુઓ અથવા સીટીનો ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ [વિડીયો](#) જુઓ.

ઈકોનોમિક ડેવલપર્સ એસોસિએશન ઓફ કેનેડા અને માર્કેટિંગ કેનેડા એવોર્ડ્સ વિશે

EDAC કેનેડાનું આર્થિક વિકાસ વ્યવસાયીઓનું રાષ્ટ્રીય મંડળ છે, જે આશરે 1,000 સભ્યો સાથે સમગ્ર કેનેડાના દરેક પ્રોવિન્સ અને ટેરિટરીનું પ્રતિનિધિત્વ કરે છે. આ એસોસિએશન જાણે છે કે સમુદાયનું માર્કેટિંગ આર્થિક વિકાસ વ્યવસાયનો અખંડ ભાગ છે. માર્કેટિંગ કેનેડા એવોર્ડ્સ કેનેડાવાસીઓની આર્થિક સુખાકારી સુધારવાના દૃષ્ટિકોણ સાથે કેનેડિયન પ્રોવિન્સીસ, ટેરિટરીસ, રીજીયન્સ, શહેરો, નગરો અને વિસ્તારોને પ્રોત્સાહિત કરતી અને બજાર ઊભું કરતી સંસ્થાઓ માટે ખુલ્લા છે.

અવતરણો (ક્વોટ્સ):

“બ્રેમ્પટન રોમાંચક પરિવર્તનની વચમાં છે, અને અમે આપણાં ભાગીદારો સાથે મળીને, આપણાં ઇનોવેશન ડિસ્ટ્રિક્ટને મોટા શૈક્ષણિક અને નવીન શોધનું કેન્દ્ર તરીકે વિકસાવી રહ્યાં છીએ. આપણે જાણીએ છીએ કે નવીન શોધમાં વૈશ્વિક અગ્રણી તરીકે આપણને ઓળખાવવામાં માર્કેટિંગ મહત્વની ભૂમિકા ભજવે છે, અને અમે બ્રેમ્પટનની ઘણી શક્તિઓની ઝાંખી કરાવીને ચાલુ રોકાણ આકર્ષવા કટિબદ્ધ છીએ. અમે ગૌરવ અનુભવીએ છીએ કે ઈકોનોમિક ડેવલપર્સ એસોસિએશન ઓફ કેનેડાએ અમારા ઇનોવેશન ડિસ્ટ્રિક્ટ વિડીયોને ઓળખ આપી છે.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“ડાઉનટાઉન બ્રેમ્પટનને નવીન શોધ અને ઉદ્યોગ સાહસિકતાનું કેન્દ્ર તરીકે સ્થાપવાનું ચાલુ રાખીને, આપણે એ વિકાસ ચલિત કરી રહ્યાં છીએ જેનાથી આપણાં રહેવાસીઓ, વિદ્યાર્થીઓ અને ધંધાઓને લાભ થશે. ઇનોવેશન ડિસ્ટ્રિક્ટ વિડીયો આપણી ઇનોવેશન ઈકોસિસ્ટમના પ્રભાવોની ઝાંખી કરાવવાનું ઉત્કૃષ્ટ કામ કરે છે, અને આપણાં ડાઉનટાઉનના હાર્દમાં રોકાણ ઊભું કરવાનું અમે ચાલુ રાખીએ છીએ ત્યારે તેનાથી આપણને ટેકો મળશે. તેને ઈકોનોમિક ડેવલપર્સ એસોસિએશન ઓફ કેનેડા દ્વારા ઓળખ મળવી એ એક સન્માનજનક બાબત છે.”

- માર્ટિન મિડીરોસ (Martin Medeiros), રીજીયનલ કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4; પ્રમુખ, આર્થિક વિકાસ, સીટી ઓફ બ્રેમ્પટન

“અમે આપણાં ઇનોવેશન ડિસ્ટ્રિક્ટમાં મહત્વની પહેલો આગળ વધારીને, આપણાં ડાઉનટાઉનની સંભવિતતા પુનર્જીવિત અને ઉઘાડી રહ્યાં છીએ, અને સંપૂર્ણ સમુદાયો બનાવી રહ્યાં છીએ. બ્રેમ્પટનનો અર્થ ધંધાનો થાય છે, અને આપણો ઇનોવેશન ડિસ્ટ્રિક્ટ વિડીયો તે પ્રદર્શિત કરવાનું ઉત્કૃષ્ટ કામ કરે છે. આપણું મૂલ્યવાન ઇનોવેશન ડિસ્ટ્રિક્ટ ભાગીદારોને સાથે રાખીને, આપણે વિશ્વ સ્તરીય શિક્ષણ અને નવીન શોધ કેન્દ્ર, આપણાં શહેરના બિલકુલ હાર્દમાં બનાવી રહ્યાં છીએ.”

- પૉલ વિસેન્ટ (Paul Vicente), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5; ઉપાધ્યક્ષ, આર્થિક વિકાસ અને સંસ્કૃતિ, સીટી ઓફ બ્રેમ્પટન

આપણી આર્થિક વિકાસ ટીમનું આપણાં સમગ્ર સમુદાયને લાભ આપવા આપણાં શહેરને શિક્ષણ અને નવીન શોધના કેન્દ્રમાં વિકસાવવાના માર્ગમાં સીટીનું અગ્રેસર બનવાનું ચાલુ છે. કેનેડાના ઇનોવેશન કોરિડોર, મૂલ્યવાન ભાગીદારીઓ, અને કુશળ અને વૈવિધ્યસભર પ્રતિભા સેતુ પર આપણાં મુખ્ય સ્થળ વડે, આપણે આપણાં ડાઉનટાઉનની સંભવિતતા ઉઘાડી રહ્યાં છીએ, જેને આપણાં ઇનોવેશન ડિસ્ટ્રિક્ટ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાડવામાં આવી છે.”

- ક્લૉર બાર્નેટ (Clare Barnett), ડાઈરેક્ટર, આર્થિક વિકાસ, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

मिडिया संपर्क (MEDIA CONTACT):

सीटी ओड् ब्रॅम्पटन मल्टिकल्चरल मिडिया

multiculturalmedia@brampton.ca